



મૃત દરદી/જામીન ખાતા ઉકેલ	RC-012
પેન સ્ટેટ હેલ્થ એન્ડ રેવેન્યુ સાયકલ	અમલીકરણ તારીખ: 5/1/2017

હેતુ

જે દરદી / જામીન મૃત્યુ પામ્યા છે તેમની સામે દાવો દાખલ કરવા અંગેના નિયમનોની પૂર્તતા સુનિશ્ચિત કરવી; કોઈ વારસો સ્થાપિત થયો છે કે કેમ તે સુનિશ્ચિત કરવા એક વિગતવાર સમીક્ષા પુરી કરવામાં આવે; વારસાની અસ્ક્યામતો હોય ત્યારે ચુકવણી બાકી હોય તે ઋણ મંજૂર કરાય અને ચૂકવાય અને જ્યાં કોઈ વારસો અથવા ઉપલબ્ધ અસ્ક્યામતો ન હોય ત્યાં ચુકવણી બાકી હોય તે ઋણની યોગ્ય રીતે પતાવટ કરવામાં આવે.

વ્યાપ

નાણાંકીય સલાહકારો

નીતિ અને/અથવા પ્રક્રિયા નિવેદનો

પેન્ન રાજ્ય સ્વાસ્થ્ય હયાત રહેતાં જીવનસાથી અને/અથવા પરિવારના સભ્ય(યો) સાથે જ્યારે તેના/તેણીના પ્રિયજન ગુજરી જાય અને તેમના મૃત્યુની સૂચના પ્રાપ્ત થાય ત્યારે બાકી રહેતી રકમનો ઉકેલ લાવવા માટે કામ કરશે. **RC-110 - પેન સ્ટેટ હેલ્થ સુવિધાઓની બહાર થતી દર્દી મૃત્યુ, જુઓ (RC-110 - Patient Expirations Occurring Outside the Penn State Health Facilities).** આમાં વારસા ઉપર દાવો દાખલ કરવાનો, નાણાંકીય સહાય અરજી પુરી કરવાનો અને દરદી પાછળ હયાત રહેનારાઓ અથવા વારસામાંથી ચુકવણી મંજૂર થાય અથવા પ્રાપ્ત થાય તેની ગોઠવણીનો સમાવેશ થઈ શકે.

- જીવનસાથી હયાત હોય તે કિસ્સામાં જામીન તરીકે હયાત રહેલ જીવનસાથીને બદલવામાં આવશે.
 - જો હયાત રહેલ જીવનસાથી ચુકવણી કરવામાં અસમર્થ હોય અથવા કોઈ વારસો ન હોય, તો તે / તેણી નાણાંકીય સહાય કાર્યક્રમ માટે પાત્ર બને છે કે કેમ તે નક્કી કરો.
 - વસૂલાતની સામાન્ય પ્રક્રિયાઓ થકી ખાતું વસૂલ કરવાના નિષ્ફળ પ્રયત્નો પછી, મૃતક દરદીઓના ખાતાની બાકી રકમ લાગુ પડતા ગોઠવણી વિનિમય કોડનો ઉપયોગ કરીને લખી વાળવામાં આવે છે.
 - જો હયાત રહેલ જીવનસાથી ચૂકવી શકવામાં સમર્થ હોય, તો ચૂકવણી સ્વીકારો અથવા જરૂર હોય તે મુજબ ચૂકવણી યોજના સ્થાપિત કરો.

- જો દરદી એકલ, છૂટાછેડા લીધેલ અથવા વિધવા/વિધુર હોય:
 - જો બાકી રકમ \$1,000 કરતાં ઓછી હોય:
 - બિલિંગ પ્રણાલીમાં નોંધેલા હોય તેવા સૌથી નજીકના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરો.
 - જો સંપર્ક ન કરી શકાતો હોય અથવા ભંડોળ ઉપલબ્ધ ન હોય તો ખાતું નાણાંકીય સહાય કાર્યક્રમ માટે ધ્યાને લઈ શકાય.
- જો બાકી રકમ \$1,000 કરતાં વધુ હોય:
 - બિલિંગ પ્રણાલી અથવા દરદીના વસવાટના દેશમાં વસિયતની નોંધણીમાં નોંધ થયા મુજબ જીવનસાથી અથવા સૌથી નજીકના સંબંધીનો સંપર્ક કરીને કોઈ વારસો છે કે કેમ તે નક્કી કરો.
 - વારસાની માહિતી મેળવો અને દાવો દાખલ કરો.
 - જો કોઈ જીવનસાથી હયાત ન હોય તો જામીનને વારસામાં બદલો.

સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભો

RC-100 પેન સ્ટેટ હેલ્થ સુવિધાઓની બહાર થતાં દર્દી મૃત્યુ (RC-100 Patient Expirations Occurring Outside the Penn State Health Facilities)

મંજૂરીઓ

	નામ	શીર્ષક	તારીખ
અધિકૃત કરાયું:	Dan Angel	સિનિયર ડિરેક્ટર રેવન્યુ સાઇકલ ઓપરેશન્સ	5/1/2017
મંજૂરી મેળવેલ:	Jay Shoen	રેવન્યુ સાઇકલ ડિરેક્ટર હોસ્પિટલ ઓપરેશન્સ	5/1/2017
	Rhea Heath	રેવન્યુ સાઇકલ ડિરેક્ટર પ્રોફેશનલ ઓપરેશન્સ	

ઉત્પત્તિની તારીખ અને સમીક્ષાઓ

ઉત્પત્તિની તારીખ: 5/1/2017

સમીક્ષા તારીખ(ખો):

અદ્યતન કરાયું: 5/17, St. Joseph નીતિ 2-1નું

સ્થાન લે છે 2017 પેન સ્ટેટ હેલ્થ સંયોજિત નીતિમાં ફેરફાર પામી

વિષય સમીક્ષકો અને યોગદાન કરનારાઓ

રેવન્યુ સાઇકલ ડિરેક્ટર્સ હોસ્પિટલ અને પ્રોફેશનલ ઓપરેશન્સ